



ફોર્મ નં. "પી" --- (નિયમનં. ૧૦ અને રેગ્યુલેશન નં. ૫.૧)
ભાવનગર મહાનગરપાલિકા - ભાવનગર
ટાઉન પ્લાનીંગ વિભાગ

વિકાસ પરવાનગી

ફાઈલ નં. ૧૧૧૭ તા. ૧૦/૧૨/૧૪

રજા ચિટ્ટી નં. ૪૪

કમિ.ક.મં.નં. ૧૪ તા. ૨૭/૫/૧૫

તા. ૨૮ / ૫ / ૧૫

ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૨૯ તથા ૪૯ તેમજ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ ૨૫૩ અને ૨૫૪ અન્વયે બાંધકામની વિકાસ પરવાનગી

પ્રતિ, શ્રી મહેન્દ્રસિંહ ગજુભા જાડેજા,
સરનામું:- પ્લોટ નં. ૧૦, સર્વે.નં. ૧૯૩,
ટી.પી.સ્કીમ.નં. ૧/બી (ચિત્રા), ઓ.પી.નં. ૧, એફ.પી.નં. ૧,
હાદાનગર, ભાવનગર.

અરજી સાથે નિયત ફોર્મ રજુ કરનાર પરવાનેદારની વિગત :-

આર્કિટેક્ટ/એન્જિનિયર શ્રી મહેન્દ્રભાઈ એમ.પટેલ લા.નં. ૫
સ્ટ્રક્ચર એન્જિનિયર: શ્રી:- ભાવેશભાઈ વ્યાસ લા. નં. ૭
ક્લાર્ક ઓફ વર્ક: શ્રી:- મહેન્દ્રભાઈ એમ.પટેલ લા.નં. ૫

વિકાસ કામનું વર્ણન :-

ઉપરોક્ત સ્થળના આપશ્રીએ રજુ કરેલ રહેણાકીય તથા વાણિજ્યના હેતુ માટેના સુચિત બિલ્ડીંગ પ્લાન મુજબ પાછળ દર્શાવેલ તેમજ નીચેની શરતોને આધિન વિકાસ પરવાનગી આપવામાં આવે છે. બાંધકામ પૂર્ણ થયેથી દિન ૩૦ (ત્રીસ)માં ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે.

શરત :- ઓ.સી. મેળવતા પૂર્વે હેતુકેર કર્યા અંગેનું કલેક્ટર કચેરીનું એન.ઓ.સી.રજુ કરવાની શરતે તેમજ સદરહુ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી બાબતે નીચે સુજબની વ્યવસ્થા કરવાની રહેશે.


(૧) ફ્લોર પર Fire Extinguishers ની વ્યવસ્થા કરવાની રહેશે.


(૨) Hose Reel ની વ્યવસ્થા કરવાની રહેશે.

(૩) બિલ્ડીંગની ટેરેસ પર ૫૦૦૦ લિટરની પાણીની ટાંકીની વધારાની સ્ટોરેજની વ્યવસ્થા કરવાની રહેશે.

સુચિત ઉપયોગ	બાંધકામની વિગત	બાંધકામનું ક્ષેત્રફળ ચો.મી.	રીમાર્ક્સ
રહેણાકીય/વાણિજ્ય	હયાત બાંધકામ	---	
	સૂચિત બાંધકામ	૫૨૭.૨૨	
	કુલ	૫૨૭.૨૨	


અધિક મહેદ્દનીશ ઈજનેર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા, ભાવનગર


આસિસ્ટ. પ્લા. ઓફિસર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા ભાવનગર


ટાઉન પ્લાનીંગ ઓફિસર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા ભાવનગર

** (શરતો પાછળ દર્શાવેલ છે)



- (૧) આ પરવાનગીની મુદત એક વર્ષની રહેશે.
- (૨) આ પરવાનગી સામે અપીલ થાય તો અપીલમાં વિરુદ્ધ ઠરાવ થયેથી પરવાનગી રદ ગણાશે.
- (૩) બાંધકામની પરવાનગી મળ્યેથી દિન-૩૦ માં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગેથી ધોરણસરના ડ્રેનેજ પ્લાન મંજૂર કરાવી લેવાના રહેશે.
- (૪) બી.પી.એમ.સી. એક્ટ કલમ-૩૧૩ માં નિર્દેશ કર્યા પ્રમાણેના ધંધા અગર અન્ય ઉપયોગ માટે મકાનનો કે કોઈપણ જગાનો ઉપયોગ કરતાં પહેલાં મહાનગરપાલિકા ના પેટા કાયદા અનુસાર જરૂરી વેપાર અગર બીજા પરવાના મેળવવાના રહેશે.
- (૫) સદરહું જમીન અંગે બીન ખેતીના હુકમો તથા લે-આઉટ પ્લાનની મંજૂરી જે શરતો આધિન અપાયેલ હોય તે ચેકિ કોઈપણ શરતોનો ભંગ થયેલ હશે અથવા થશે તો પરવાનગી રદ ગણાશે.
- (૬) મહાનગરપાલિકાના લીઝથી અપાયેલ પ્લોટમાં કોઈપણ શરતોનો ભંગ થશે તો આ પરવાનગી રદ ગણાશે. આ પરવાનગીથી લીઝ અંગેની જરૂરી મંજૂરીઓ મેળવી છે તેવું ગણાશે નહીં.
- (૭) ચાલુ બાંધકામના કોઈપણ તબક્કે બાંધકામ મંજૂરી સમયે આપના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ કોઈપણ માન્ય પરવાનેદાર તેમની નિયુક્તિ રદ કરાવે અથવા કોઈ કિસ્સામાં અત્રેની કચેરી દ્વારા શિક્ષાત્મક પગલાંનાં કારણે પરવાનેદારનો પરવાનો રદ કરવામાં કે સ્થગીત કરવામાં આવે તો તે સમયે આપના દ્વારા અન્ય પરવાનેદારને નિયુક્ત કરવામાં આવ્યાની જાણ કર્યા બાદ જ આગળનું બાંધકામ કરવાનું રહેશે. અન્યથા તે સમયગાળા દરમિયાન થયેલું બાંધકામ અન અધિકૃત ગણીને ધારાસર કાર્યવાહી હાથ કરવામાં આવશે.
- (૮) બાંધકામના દરેક તબક્કે પ્રગતી અહેવાલ આપવાનો રહેશે.
- (૯) બાંધકામ પૂર્ણ થયે નિયમાનુસાર કમ્પ્લીશન પ્લાન મંજૂર કરાવી ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે. ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવ્યા સીવાય મકાન કે તેના કોઈપણ ભાગનો ઉપયોગ કરી શકાશે નહીં.
- (૧૦) બાંધકામ મંજૂરી માટે મહાનગરપાલિકા ને આપવામાં આવેલ તમામ કબુલાતનામા તેમજ બાહેધરીનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૧૧) કોઈપણના કાયદેસરના હકક હીતને નુકશાન ન થાય તે પ્રમાણે બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) આ મંજૂરીથી કોઈ કાનુની વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગેના ખર્ચ/નુકશાની વળતરની જવાબદારી મહાનગરપાલિકા ની રહેશે નહીં.
- (૧૩) બાંધકામ મંજૂરી મેળવનાર દ્વારા કોઈપણ હકીકત છુપાવીને કે ખોટી રજુઆત કરીને મંજૂરી મેળવેલ હોવાનું જણાશે તો આપવામાં આવેલ મંજૂરી કોઈપણ નોટીસ વિના રદ કરવામાં આવશે તેમજ જરૂરી કાનુની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
- (૧૪) પ્રવર્તમાન અન્ય તમામ કાયદાઓ તથા નિયમો અનુસાર લેવાની થતી જરૂરી યોગ્ય મંજૂરીઓ અથવાપ્રમાણપત્રો જે તે સંબંધીત સક્ષમ અધિકારી પાસેથી મેળવ્યા બાદ જ બાંધકામ શરૂ કરવાનું રહેશે. તે શરતે આ મંજૂરી આપવામાં આવે છે.
- (૧૫) સરકારશ્રીના તા. ૨૭-૭-૦૪ નાં હુકમ મુજબ ઓક્યુપન્સી સર્ટી મેળવતાં પૂર્વે વરસાદી પાણીના ભુતળ જળ સંગ્રહની વ્યવસ્થા કરી આપવાની શરતે આ મંજૂરી આપવામાં આવે છે. આ અંગેની જરૂરી વિગતો અત્રેથી મેળવી લેવાની રહેશે.
- (૧૬) આ વિસ્તાર ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ હેઠળની ટી.પી.સ્કીમમાં સમાવેશ થતો હોય, આ ટી.પી.સ્કીમ અંગે સરકારશ્રી/ ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી / મહાનગરપાલિકાશ્રી દ્વારા જે નિર્ણયો લેવામાં આવે તે બંધનકર્તા રહેશે.

વિકાસ પરવાનગી તથા મંજૂર નકશા મળેલ છે.

(એન્જીનીયર/ડેવલપર/માલિક ની સહી)